



કાઇમ બ્રાંચ, સુરત શહેર

સરનામુ- ચોક બજાર કુરજા, ધનરાજ પેટ્રોલ પંપની

બાજુમાં, સુરત શહેર

સંપર્ક નંબર-૦૨૬૧-૨૪૩૬૦૨૪



દેશી હાથ બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે રીઢા આરોપીને ઝડપી પાડતી,

સુરત શહેર કાઇમ બ્રાંચ

પોલીસ કમિશ્નરશ્રી તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફિક એન્ડ કાઇમ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી કાઇમ નાઓએ અગામી ચુટણી અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે નામચીન ગુનેગારો તથા હથીયારો સાથે રાખી ફરતા તથા વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા સુચના કરેલ જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી કાઇમ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી.બી. ના માર્ગદર્શન હેઠળ કાઇમ બ્રાંચના પો.સ.ઈ. એમ.એસ. ત્રિવેદી ટીમ સાથે પેટ્રોલીંગમા હતા દરમ્યાન હે.કો. સત્યપાલસિંહ મહોબતસિંહ તથા જીજ્ઞેશભાઈ બાબુભાઈ નાઓને મળેલ બાતમી હકિકત આધારે લીંબાયત ગોડાદરા જોગાણી માતા ચોક પાસેથી આરોપી ચીરાગ રેવાભાઈ ભરવાડ (મેર) ઉ.વ.૨૩ રહે. મકાન નં.૧૦૨,૧૦૩, જીજ્ઞેશનગર, પટેલ નગરની બાજુમાં ગોડાદરા, સુરત, મુળ રહે. માંડવાગામ તા.સ્વામીના ગઢડા જી.ભાવનગર નાને દેશી હાથ બનાવટની પિસ્ટલ નં-૧, તથા જીવતા કાર્ટીઝ નં-૨, સાથે ઝડપી પાડી ડી.સી.બી. પો.સ્ટે. II ગુ.ર.નં. ૩૧/૨૦૧૯ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(એ) તથા GPA ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મજકુર આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે, પોતે સને-૨૦૧૪ થી જમીન તથા મકાનની દલાલીનુ કામ કાજ કરતો આવેલ દરમ્યાન સંજય આગ્રા નામના ઈસમે તેની ઉપર ધંધાકીય અદાવતમા ફાયરીંગ કરેલ ત્યાર બાદ સને-૨૦૧૭ મા તેના મિત્ર પ્રકાશ પાંડેની રાજુ યાદવ તથા તેના મિત્રો સાથે મારામારી થયેલ જેથી પોતે તેના મિત્રો સાથે મળી રાજુ યાદવ તથા તેના મિત્રોના ઘરે જઈ મારા મારી કરી, તોડફોડ કરેલ. જેથી મજકુર આરોપીને પોતાની જાનનો ભય લાગતા પોતે સુભમ બીહારી નામના ઈસમ પાસેથી ૪૫,૦૦૦/- માં હથીયાર તથા કાર્ટીઝ ખરીદી પોતાની સેફ્ટી માટે પોતાની પાસે રાખી મુકેલ. જે આજ રોજ પોતાની સાથે લઈ નિકળતા પકડાઈ ગયેલ છે. મજકુર આરોપી ખોલવડ ગામ ખાતે હાઝનભાઈ તૈબી સરપંચ પર થયેલ ફાયરીંગ કેશમાં તથા લીંબાયત પોલીસ સ્ટેશન મોડલ ટાઉન વિસ્તારમાં ગોલુ રાજપુત નામાના ઈસમની હત્યાની કોશીષ તથા મારા મારીના ગુનામા પકડાઈ ચુકેલ છે. જે ગુનાઓની વિગત નીચે મુજબ છે.

(૧) લીંબાયત પો.સ્ટે. II ગુ.ર.નં. ૮૮૯/૨૦૧૬ ઈ.પી.કો. કલમ. ૪૨૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ (૨) લીંબાયત પો.સ્ટે. I ગુ.ર.નં. ૭૦/૨૦૧૭ ઈ.પી.કો.કલમ.૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૭,૩૨૪,૫૦૩ તથા જી.પી.એક્ટ કલમ. ૧૩૫ મુજબ (૩) લીંબાયત પો.સ્ટે. II ગુ.ર.નં. ૪૫૦/૨૦૧૭ ઈ.પી.કો. કલમ. ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ (૪) લીંબાયત પો.સ્ટે. II ગુ.ર.નં.૧૯૬૩/૨૦૧૭ ઈ.પી.કો.કલમ.૩૨૩,૪૨૭,૫૦૪,૫૦૩,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ(૫) કામરેજ પો.સ્ટે. I ગુ.ર.નં. ૨૩૦/૨૦૧૮ ઈ.પી.કો. કલમ. ૩૦૭,૩૪,૧૨૦(બી),૧૧૪ તથા આર્મ્સ એક્ટ કલમ. ૨૫(૧-એ),૨૦(૧) મુજબ.